

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસને વર્લ્ડ ચેમ્પિયન્સ તરીકે ઓળખ મળી બ્રેમ્પટન ફાયરે અલાબામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ સ્થાનની સંખ્યાબંધ પદવીઓ જીતી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ફેબ્રુઆરી 5, 2020) – આજરોજ સીટી કાઉન્સિલની બેઠકમાં, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના સભ્યોને ફાયરફાઈટર કોમ્બેટ ચેલેન્જ વર્લ્ડ કમ્પિટિશનમાં પોતાના સુવર્ણ પદક પ્રદર્શન માટે ઓળખ મળી હતી.

બ્રેમ્પટનની ટીમ – ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અને ડિસ્ટ્રિક્ટ ચીફ, પીટર રીડ (Peter Reid) ની આગેવાનીમાં – બ્રેમ્પટનના પાંચ અગ્નિશામકોની બનેલી; કેટી રોસ (Katie Ross), ડેન પાલ્મર (Dan Palmer), એન્થની બુર્ચ (Anthony Burch), રાયન ડોસમેન (Ryan Dosman) અને ઈયાન પ્રિંગલ (Pringle), જેઓએ સંખ્યાબંધ વ્યક્તિગત અને ટીમ રેસીસમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.

દર વર્ષે, સમગ્ર ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટના સ્પર્ધકો પોતાના દેશમાં વર્લ્ડ ચેમ્પિયન પદવી લાવવાની આશામાં બહુવિધ દિવસીય આયોજનોમાં ભાગ લે છે. 2019 ચેમ્પિયનશીપ ઓક્ટોબર 2019 માં મોન્ટગોમરી, અલાબામાં યોજાઈ હતી.

વિશ્વ સ્તરે ભાગ લેતા પહેલાં, ટીમે સપ્ટેમ્બર 2019 માં ઓશાવામાં નેશનલ ફાયરફાઈટ સ્પર્ધામાં પણ સંખ્યાબંધ પદવીઓ જીતી હતી.

બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2020 માટે તાલીમ આયોજનો પહેલેથી થઈ રહ્યાં છે ત્યારે, આ ટીમ બ્રેમ્પટન ફાયર ટીમમાંથી નવા સભ્યોની ભરતી કરવા અને ગયા વર્ષની સફળતાનું પુનરાવર્તન કરવા આશાવાદી છે.

સંખ્યાબંધ

- કેટી રોસ (Katie Ross) મહિલા વ્યક્તિગત શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.
- ડેન પાલ્મર (Danny Palmer) અને કેટી રોસે કોએડ ટેન્ડમ શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.
- કેટી રોસ અને એલિસા કારવેલો (વૉને) (Elissa Carvello (Vaughan)) મહિલા ટેન્ડમ શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.
- કેટી રોસ, એલિસા કારવેલો (વૉને) અને કેલ્ટી મે નિકોલે (આલ્બર્ટા) મહિલા ટીમ રીલે શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું હતું.
- ઈયાન પ્રિંગલ (Ian Pringle), ડેન પાલ્મર અને રાયન ડોસમેન (Dosman) વ્યક્તિગત ટીમ શ્રેણીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
- ઈયાન પ્રિંગલ અને ડેન પાલ્મરે પુરુષોની ટેન્ડમ શ્રેણીમાં નવમું સ્થાન મેળવ્યું હતું.

અવતરણો (ક્વોટ્સ):

“આ ઉપલબ્ધિઓ આપણી બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી ટીમો દરરોજ સખત મહેનત કરે છે અને તાલીમ મેળવે છે તેની ઉત્કૃષ્ટ વસિયત છે. અમે અમારા અગ્નિશામકોની ઉત્કૃષ્ટતા પ્રત્યે કટિબદ્ધતા માટે તેઓના આભારી છીએ અને વર્ષ 2020 માં તેઓનો ઉત્સાહ આગળ વધારવા આશાવાદી છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણી બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સેવાઓ ઉદ્યોગમાં જે રીતે દુનિયાભરમાં આગેવાન છે તેનું અન્ય એક ઉદાહરણ દર્શાવે છે. બ્રેમ્પટનવાસીઓને ગૌરવવંતા બનાવવા બદલ આપનો આભાર અને ટીમને અભિનંદન!”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર અને અધ્યક્ષ, સમુદાય સેવાઓ

“આ એક પ્રભાવશાળી પરાક્રમ છે જે કરવામાં ધનિષ્ઠ તાલીમ, મહાવરો, કટિબદ્ધતા અને સમર્પણની જરૂર પડે છે. મને અમારી ટીમની વિપુલ ઉપલબ્ધિઓ અને આ સ્પર્ધાઓમાં વિભાગીય સફળતાના લાંબા ઇતિહાસનું ગૌરવ છે.”

- બિલ બોયસ (Bill Boyes), ફાયર ચીફ, બ્રેમ્પટન ફાયર અને ઈમરજન્સી સેવાઓ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca